https://archive.org/details/bk1437/page/n0/mode/1up

1955-01-18 -KKP Sanatan Yuvak Sangh Dhansura -Constitution (1437)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

શ્રી

કડવા પાટીદાર સનાતન

યુવક સંઘના

આદેશ

અને

બંધારણ

સ્થાપના : ૧૮-૧-૧૯૫૫

સંવત ૨૦૧૪] પ્રત ૫૮૦ [સને ૧૯૫૭

Kantilal K. Patel

realpatidar.com

https://archive.org/details/bk1437/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 3.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1437/page/n2/mode/1up

1955-01-18 -KKP Sanatan Yuvak Sangh Dhansura -Constitution (1437)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.23 15:18:15 +05'30'

realpatidar.com

ૐ

શ્રી

કડવા પાટીદાર સનાતન યુવક સંઘના

આદેશ અને બંધારણ

સ્થાપના : ૧૮-૧-૧૯૫૫

સંવત ૨૦૧૪] પ્રત ૫૮૦ [સને ૧૯૫૭

Kantilal K Patel

realpatidar.com

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk1437/page/n4/mode/1up

realpatidar.com

વહાલા બંધુઓ,

આપણને આ પ્રદેશમાં આવ્યા ને આજે ચારથી પાંચ દશકાઓ થઈ ગયા, આપણે કેટલીક કૃત્રિમ અને કુદરતી આફતોનો સામનો કરી આજે ઠીક ઠીક આબાદ બન્યા, તેવીજ રીતે આપણે સનાતન સમાજની સમાજ રચના કરવામાં પણ કેટલીક આફતોનો સામનો કરી સમાજને સારી પ્રગતિના માર્ગે સફળ કરી શકયા.

આજે દુનિયાના બધા દેશો સાથે આપણો ભારત દેશ પણ સારી એવી પ્રગતિના માર્ગે આગળ ધપ્યે જાય છે. આ બધું જોતાં હજુ આપણે જોઇએ તેટલા પ્રગતિશીલ બન્યા નથી.

આપણા સમાજને સમાજ પ્રવૃત્તિમાં મદદરૂપ બનવા માટે યુવક સંઘ રચવાની જરૂર જણાઈ તેથી તેમણે તા. ૧૮-૧-૫૫ ના રોજ યુવકોની એક જનરલ સભા બોલાવી પોતાનો આદેશ રજુ કર્યો. સમાજનો આવો ઉચ્ચ આદેશ યુવકોએ હર્ષથી વધાવી લીધો અને તેજ દિવસે યુવક સંઘની સ્થાપના થઇ. યુવક સંઘ સ્થપાયા પછી આજ સુધી જોઇએ તેટલી પ્રગતિ પામ્યો નથી તેનું એક જ કારણ છે, કે આપણા કેટલાક યુવકો સંઘમાં જોડાવું તે શરમ ભરેલું ગણે છે. પણ તે બરાબર નથી. કારણ કે આજે સહકારનો જમાનો છે. માટે આ જમાનામાં આપણે સહકારથી અને સંઘબળથી રહેવું વધુ અનુકુળ થઈ પડશે.

હાલમાં આપણા કેટલાક યુવકો સમાજ વિરૂધ્ધ વર્તન જેવું કે સામાજીક મનોરંજન કાર્યક્રમને બદલે ભવાઈ જેવા નાચકુદના કાર્યો કરે છે તે બરાબર નથી. છતાં તેવા યુવકોને તુચ્છકારી ન કાઢતાં સહકારથી સમજાવી તેવાં વર્તન ન કરવા દેવાનો આ સંઘનો ઉદ્દેશ છે.

સંઘના બંધારણ મુજબ સને ૧૯૫૮ ની સાલમાં ત્રણ વરસ પુરા થતાં હોઈ યુવકોની જનરલ સભા બોલાવી સંઘના હોદ્દેદારો અને કાર્ય-વાહક કમીટીની લોકશાહી રીતે રચના કરવામાં આવશે. જનરલ સભાની તારીખની દરેક યુવક ભાઇઓને ખબર આપવામાં આવશે તો તે વખતે જેમ બને તેમ મોટી સંખ્યામાં હાજરી આપવા દરેક ભાઇઓને નમ્ર વિનંતી છે. અસ્તુ.

લી.

વેલજીભાઇ પ્રેમજીભાઈ પટેલ

ચેરમેન,

કડવા પાટીદાર સનાતન યુવક સંઘ.

realpatidar.com

https://archive.org/details/bk1437/page/n5/mode/1up

realpatidar.com

સંઘનું બંધારણ અને તેનો ઉદ્દેશ.

(૧) ગુજરાતના પ્રથક પ્રથક ગામડા (કમ્પાઓમાં) વસી રહેલા સમાજના જનસમુહમાંથી કોઈપણ યુવક ભાઈ કે જેની ઉંમર ૧૮ થી ૪૦ વરસ સુધીની હોય અને જેનો "યુવક સંઘ" નોંધાયેલા સભ્યો બહુમતિ વડે ખાસ વિરોધ ન કરે તેવા દરેક ભાઈને આ યુવક સંઘના સભ્યપદે લેવામાં આવી શકાશે.

(૨) આ યુવક સંઘનો ઉદ્દેશ સમાજમાં શિસ્ત, કેળવણી, આમ્યરક્ષણ, સમાજ સંસ્કાર અને નાના મોટા સમાજ સમારંભોમાં સ્વયંસેવક દળ તરીકેની દરેક પ્રવૃત્તિઓ રચનાત્મક રીતે હલ કરવાનો રહેશે.

(૩) સદરહુ યુવક સંઘ તેના પ્રત્યેક સભ્ય અને પ્રધાન કાર્યવાહક સહિત સમાજના જનરલ બંધારણ અને તેના ખાસ ઉદ્દેશોને અનુસરી પોતાની પુરતી ફરજો પાળવા અને પળાવવા બંધાએલો રહેશે.

(૪) આ યુવક સંઘની સ્થાપના તા. ૧૮-૧-૧૯૫૫ના દીને હાજર થઈ નોંધાએલા સભ્યોમાંથી બહુમતીના ધોરણે ૩૦ (ત્રીસ) આગેવાન સભ્યોની બનેલી કાર્યવાહક કમિટીની નીમણુંક કરી તે કમિટી દ્વારા સંઘના પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી વગેરેની વરણી પદ્ધતિસર કરેલી છે. આવી ચુંટણી પ્રતિ ત્રણ વરસના અંતરે આ યુવક સંઘ પોતાની ખાસ સભા ભરી (કરી) શકશે અને જ્યાં સુધી પધ્ધતિસરની નુતન વરણી ન થઈ શકે ત્યાં સુધીના સમય દરમ્યાન આગળ ચુંટાયલા કાર્યવાહકો અમલી અને માન્ય ગણાઈ શકાશે.

(૫) આ યુવક સંઘની પ્રતિ માસે કાર્યવાહક કમીટીની સભા મુકરર કરેલા વખતે

अ. સંઘની ઓફિસ ધનસુરા મુકામે ભરવાનો કાયમી ઠરાવ કરવામાં આવેલ છે જેમાં સદરહુ સંઘના દરેક સભ્યો તેમજ કાર્યવાહકે અવશ્ય હાજરી આપવાનું નક્કી કરવામાં આવેલ છે.

(ब) ખાસ આવશ્યક કારણોમાં સંઘના પ્રમુખ અગાઉની ચેતવણીથી સંઘની ખાસ સભા કોઈપણ વખતે બોલાવી શકશે.

(क) સંઘની કોઈપણ સભામાં હાજર રહેલા સભ્યોએ બહુમતી ધોરણે મંજુર કરેલા કોઈ ઠરાવને લઘુમતી ધરાવતા સભ્યોએ

realpatidar.com

https://archive.org/details/bk1437/page/n6/mode/1up

realpatidar.com

તેમજ ગેરહાજર રહેલા સભ્યોએ જવાબદારીપૂર્વક મંજુર રાખવાના રહેશે.

(ड) સદરહુ યુવક સંઘના સભ્યપદ નોંધાવનાર પ્રત્યેક સભ્ય ભાઈએ લવાજમ તરીકે વાર્ષિક રૂા. ૧) સંઘને ભરવાનો રહેશે, આવી લવાજમ ફંડની રકમ સંઘના બહુમતી ઠરાવ વડે મંજુર થએલા ઉચીત કાર્યોમાં ખર્ચવામાં આવશે.

(૬) જનરલ સમાજના બંધારણીય ઉદ્દેશોને અનુસરી ઉન્મતિશીલ પાયા પર ઘડી કાઢેલા ઠરાવોને સદરહુ "યુવક સંઘ" પોતાની વિધિસરની બહુમતિ વડે પાસ કરી તેવા ઠરાવોને તે સમાજની કાર્યવાહક કમીટી સમક્ષ રજુ કરી શકશે, અને રજુ થએલા દરેક ઠરાવને સમાજની કાર્યવાહક કમીટી પૂર્ણ નિરિક્ષણ બાદ પોતાના બહુમતિ ધોરણ મુજબ ઉચીત એવી બહાલી આપી શકશે.

(अ) સદરહુ સંઘનો કોઈ પણ ઠરાવ જે સમાજની જનરલ કમીટીની વિધીસરની બહાલી મેળવ્યા વગરનો હોય તે કોઈપણ સંજોગોમાં અમલી (માન્ય) ગણી શકાશે નહિ.

(ब) સદરહુ યુવક સંઘનો કોઈપણ ઠરાવ સમાજની જનરલ કમીટીની બહાલી મેળવ્યાથી તે ઠરાવને સમાજના અંગરૂપ દરેક ગામમાં કે કમ્પામાં અમલી (માન્ય) બનવા અને બનાવવાની ફરજ આ સંઘના જેના તે ગામના યુવક સભ્યની રહેશે.

(क) આ સંઘના પ્રત્યેક સભ્યની ખાસ ફરજ રાખવામાં આવે છે કે પોતાના ગામમાં અગર નિકટવર્તી વર્તુલમાં સમાજની જનરલ કમીટીના રહેતા સભ્યને દરેક રીતે સમાજકાર્યમાં સહાયતા (સહકાર) આપવો.

(૭) સદરહુ યુવક સંઘના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી તેમજ દરેક સભ્યે પોતાના સંઘોચિત કાર્યક્રમમાં ફરજ પર રહી દર કાર્ય દરપળે સંઘની તેમજ સમાજની બહુમત લાગણીનું લક્ષ અનુમોદનમાં લઈ પોતાના ધર્મ અને વફાદારીનું વિશ્વાસપૂર્વક પાલન કરવાનું રહેશે.

(૮) આ યુવક સંઘના પ્રમુખ, સંઘના આદર્શ અનુસારે સંઘકાર્યમાં

realpatidar.com

https://archive.org/details/bk1437/page/n7/mode/1up

realpatidar.com

એકી વખતે એકી સાથે રૂા. ૨૫) નું યોગ્ય ખરચ કરી શકશે અને સંઘના સેક્રેટરી તદનાનુસારે એકી વખતે એકી સાથે રૂા. ૧૦) સુધીનું ખર્ચ કરી શકશે. તે ઉપરાંતના વધારે પડતા ખર્ચ માટે પ્રમુખ, સેક્રેટરી સહીતંના ત્રીસ સભ્યોવાળી કમિટીની વિધીસરની સભાના ઠરાવ દ્વારા મંજુર થઇ તે સમાજની જનરલ કમીટી પાસે મંજુર કરાયેલા ક્રમમાં થઇ શકશે.

(૯) યુવક સંઘની કાર્યવાહક કર્મીટીની સભામાં સંઘના નવિન સભ્યો નોંધાવવાનું આવશ્યક સંજોગોમાં સંઘના પ્રમુખ મંજુર કરી શકશે.

(અ) વિધીસરનું રાજીનામું આપ્યા બાદ કોઇપણ ભાઇ સંઘના ખર્ચ ઉપજના કોઇપણ એકાઉન્ટને માંગી અગર તપાસી શકશે નહિ.

(૧૦) સદરહુ સંઘના કોઈપણ સભ્યને અગર તેના કાર્યવાહકને સમાજની કાર્યવાહક કમીટી આવશ્યક સંજોગોમાં પોતાના કામચલાઉ સભ્ય તરીકે લઈ શકશે અને પ્રતિ ત્રણ વરસના ધોરણે સમાજમાં કાર્યવાહક કમીટી માટે વિધિસરની ચુંટણી થાય તે સમયે તેવા સભ્યને સમાજના બહુમતી ધોરણ પર કર્મીટીના કાયમી સભ્યપદ માટે ઉમેદવાર થવાના હક રહેશે.

(૧૧) સદરહુ સંઘના પ્રમુખ, સેક્રેટરીને સંઘના દરેક સભ્ય કાર્યને દોરવણી અને તપાસ કરવાની ફરજ રહેલી છે. તેમજ સંઘના આવક જાવકના હિસાબોમાં હંમેશાં ચોખવટ રાખવાની જવાબદારી સંઘના ખજાનચીની રહેશે. સદરહુ સંઘના ખજાનચીએ ચાલુ ખર્ચ પુરતા વધારેમાં વધારે રૂા. ૫૦) સુધીની રકમ પોતાના હસ્તક રાખી, તે ઉપરની સંઘની રકમ સમાજના જનરલ કેશના ચોપડે જમા કરાવવી પડશે. તેમજ જનરલ સમાજના વાર્ષિક અહેવાલની સાથે સંઘના દરેક હિસાબો રિપોર્ટ દ્વારા સમાજમાં જાહેર કરવાના રહેશે.

(૧૨) આ ઉપર મુજબના બંધારણના બાર ઠરાવો સંઘના અમો સૌ હાજર રહેલા સભ્યોએ સર્વાનુમતે ઘડી કાઢીને સંઘને પાલન કરવા અર્થે મંજુર કરેલા છે, જે સૌને બંધનકર્તા છે.

કેશવલાલ માવજીભાઈ
સેક્રેટરી,
કડવા પાટીદાર સનાતન યુવક સંઘ.

realpatidar.com

https://archive.org/details/bk1437/page/n8/mode/1up

realpatidar.com

કાર્યવાહક કમિટી અને તેના આગેવાન કાર્યકર્તાઓ

૧	પટેલ વેલજીભાઈ પ્રેમજીભાઇ	પ્રમુખ	હડમતિઆ કંપા
૨	,, વાલજીભાઇ કરમસીભાઇ	ઉ. પ્રમુખ	કાશીપુરા કંપા
૩	,, કેશવલાલ માવજીભાઇ	સેક્રેટરી	હીરાપુર કંપા
૪	,, નાનજીભાઈ કાનજીભાઇ	જો. સે.	રાયણુનો માળ
૫	,, વશરામભાઇ નથુભાઇ	આ. સે.	અણીઓર કંપા
૬	,, લાલજીભાઇ ખેતસીહભાઇ	ખજાનચી	સરડી કંપા
૭	,, હીરાભાઈ લાલજીભાઇ	સભ્ય	અમીનપુરા
૮	,, હરીભાઇ ખેતાભાઇ	,,	વિષ્નુપુરા
૯	,, દેવજીભાઇ નારાયણુભાઇ	,,	શાન્તીપુરા
૧૦	,, ધનજીભાઈ દાનજીભાઇ	,,	ખરોડ કંપા
૧૧	,, સોમજીભાઇ મનજીભાઇ	,,	રામસી કંપા
૧૨	,, કચરાભાઇ દેવજીભાઇ	,,	અમલાઇ
૧૩	,, સવજીભાઇ ધનજીભાઇ	,,	એદલપુરા
૧૪	,, નારાયણુભાઇ સીવજીભાઇ	,,	મોતિવેણી કંપા
૧૫	,, ખીમજીભાઇ હીરજીભાઇ	,,	મોહનપુર કંપા
૧૬	,, પચાણુભાઇ હંશરાજભાઈ	,,	ગોવિંદપુરા
૧૭	, કાનજીભાઇ પુન્જાભાઇ	,,	બાણુી કંપા
૧૮	,, સામજીભાઇ સવગણુભાઇ	,,	હરિપુરા
૧૯	,, ધનજીભાઇ દેવજીભાઈ	,,	રાજપુર
૨૦	,, પ્રેમજીભાઇ રાજાભાઇ	,,	બોરડી ટીંબા
૨૧	,, માવજીભાઇ પ્રેમજીભાઇ	,,	વજેપુરા કંપા
૨૨	,, જેઠાભાઇ કરસનભાઇ	,,	માથાસુળીયા
૨૩	,, ગંગારામ નાનજીભાઇ	,,	બદામ કંપા
૨૪	,, કાનજીભાઇ રામજીભાઇ	,,	ટીંબા તળાવ
૨૫	,, ભીમજીભાઈ હરિભાઈ	,,	મોતીશ્રી
૨૬	,, રતિલાલ દેવશીભાઈ	,,	નવાનગર
૨૭	,, અરજણુભાઇ ભીમજીભાઇ	,,	લીંબોઈ
૨૮	,, ખેતાભાઈ કરસનભાઇ	,,	શેરપુરા
૨૯	,, જેઠાભાઈ પુન્જાભાઈ	,,	કુપા તળાવ
૩૦	,, વેલજીભાઇ અરજણુભાઇ	,,	ભુટાલ
૩૧	,, રામજીભાઈ લધાભાઇ	મદદનીસ	માધવ
૩૨	,, સવજીભાઇ ભાણુજીભાઈ	,,	લક્ષ્મીપુરા
૩૩	,, કરમશીભાઇ સીવજીભાઇ	,,	મગનપુરા

realpatidar.com

https://archive.org/details/bk1437/page/n9/mode/1up

1955-01-18 -KKP Sanatan Yuvak Sangh Dhansura -Constitution (1437)

realpatidar.com

સભ્યફી ભરેલા સભાસદોના નામ

નામ	ગામ
૧ વશરામભાઇ નથુભાઈ અણીઓર	કંપા
૨ દેવશીભાઇ પ્રેમજીભાઇ	,,
૩ જીવરામ પચાણભાઇ	,
૪ નાનજીભાઇ માવજીભાઇ	,,
૫ મનજીભાઇ મેઘજીભાઇ	,,
૬ અરજણભાઈ વેલજીભાઇ	,,
૭ સામજીભાઈ મુળજીભાઇ	,,
૮ લક્ષ્મણ માધવજી	,,
૯ સવજીભાઇ વેલજીભાઇ	,,
૧૦ પરબતભાઇ હરજીભાઇ	,,
૧૧ અરજણભાઇ લાલજીભાઇ	,,
૧૨ ગોપાળભાઈ ખેતસી	,,
૧૩ રામજીભાઇ હરજીભાઇ	,,
૧૪ હીરજીભાઇ સવજીભાઈ	,,
૧૫ માનણભાઇ પેથાભાઇ	,,
૧૬ મેઘજીભાઇ પેથાભાઇ	,,
૧૭ પ્રેમજીભાઇ દેવશીભાઇ	,,
૧૮ સામજી નથુ	,,
૧૯ ભાણજી હરજી	,,
૨૦ હંશરાજ પ્રેમજી	,,
૨૧ કરસન માધવજી	,,
૨૨ કરસન પુંજા	,,
૨૩ ખેતસીહ ખીમજી	,,
૨૪ ખેતસીં સીવજી	,,
૨૫ સવજી મેઘજી	,,
૨૬ કાનજી મેઘજી	,,
૨૭ ભીમજીભાઇ હરીભાઇ	મોતીશ્રી
૨૮ મેઘજી હરીભાઇ	,,
૨૯ કાનજી વાલજી	,,
૩૦ રાજારામ રતનસી	,,
૩૧ પરબત મણીભાઇ	,,
૩૨ હરીભાઇ પ્રેમજી	,,
૩૩ મુળજી હંશરાજ	મોતીશ્રી
૩૪ બહેચરદાસ મુળજીભાઈ	,,
૩૫ ધનજીભાઈ વિરમભાઇ	,,
૩૬ દેવજી કાનજી	,,
૩૭ નારાયણ મુળજી	,,
૩૮ ખીમજી હીરજી	,,
૩૯ રતીલાલ ડાહ્યાભાઇ	,,
૪૦ હંશરાજ મણીભાઇ	,,
૪૧ પ્રહલાદ ડાહ્યાભાઈ	,,
૪૨ મુળજી દેવજી	,,
૪૩ લખુભાઇ હીરજી	,
૪૪ હંશરાજ ખીમજી	,,
૪૫ ગંગારામ વિરમભાઇ	,,
૪૬ કાનજીભાઇ રામજીભાઇ	તળાવ ટીંબા
૪૭ મણીલાલ માવજી	,,
૪૮ નારાયણ વિશરામ	,,
૪૯ મુળજી લાલજી	,,
૫૦ માવજી કાનજી	,,
૫૧ સામજી હીરજી	,,
૫૨ ધનજી રામજી	,,
૫૩ રામજી નથુરામ	,,
૫૪ અંબાલાલ નાનજી	,,
૫૫ અરજણ મેઘજી	,,
૫૬ સામજી વિશરામ	,,
૫૭ રતીલાલ હરજી	,,
૫૮ કાન્તીલાલ ખીમજી	,,
૫૯ ગંગારામ નાનજી	,,
૬૦ અંબાલાલ મેઘજી	,,
૬૧ ધનજી પરબત	,,
૬૨ જશાભાઈ ખેતસીભાઇ	બઢામ
૬૩ નાથાલાલ માવજીભાઈ	,,
૬૪ મણીલાલ કરસનભાઇ	,,

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1437/page/n10/mode/1up

realpatidar.com

નામ	ગામ
૬૫ નારાયણ વેલજી	બદામ
૬૬ હંશરાજ વેલજી	,,
૬૭ ભવાનભાઈ જેઠાભાઇ	,,
૬૮ તુલસીદાસ રાજારામ	,
૬૯ કાન્તીલાલ કેશરાભાઇ	,,
૭૦ વિઠ્ઠલદાસ કરસનભાઇ	,,
૭૧ ગંગારામ નાનજી	,,
૭૨ માવજી સવગણ	,,
૭૩ સવજી નાનજી	,,
૭૪ નારાયણ વાલજી	,,
૭૫ કરસન કાનજી	,,
૭૬ સવજીભાઇ પ્રેમજીભાઇ	ઓરડી ટીંબા
૭૭ પ્રેમજી રાજારામ	,,
૭૮ મનુભાઈ સવગણ	,,
૭૯ ખેતાભાઇ રામજી	,,
૮૯ સોમજી નાનજી	,,
૮૧ ખીમજી માવજી	,,
૮૨ હંશરાજ કાનજી	,,
૮૩ કરસન કાનજી	,,
૮૪ હંસરાજ ઉકેડા	,,
૮૫ મેગજી નારાયણ	,,
૮૬ કાનજી રામજી	,,
૮૭ વાલજી જેઠા	,,
૮૮ મનુભાઇ જીવરાજ	,,
૮૯ રવીલાલ નાનજી	,,
૯૦ વેલજીભાઇ પ્રેમજીભાઇ	તખતગઢ કંપા
૯૧ દેવશીભાઇ વિશરામ	,,
૯૨ દેવજી અરજણ	,,
૯૩ ખીમજી હીરજી	,
૯૪ રામજી વિશરામ	,,
૯૫ પ્રેમજી સીવજી	,,
૯૬ રવજી સામજી	,,
૯૭ પચાણભાઈ પ્રેમજીભાઈ	ઓરડી કંપા નિરાશ્રીત

નામ	ગામ
૯૮ નારાયણ લધા	ઓરડી કંપા
૯૯ સવજી મેઘજી	,,
૧૦૦ માધવજી માવજી	,,
૧૦૧ વસ્તારામ માવજી	,,
૧૦૨ માનણભાઈ હરજી	,,
૧૦૩ લધાભાઇ લાલજી	,,
૧૦૪ મોહનલાલ ભાણજી	માણેકપુરા
૧૦૫ નારાયણ ભાણજી	,,
૧૦૬ જેઠાભાઇ વિશરામ	,,
૧૦૭ પ્રેમજી વિશરામ	,,
૧૦૮ કચરાભાઇ દેવજીભાઇ	અમલાઈ
૧૦૯ હીરજી દેવજી	,,
૧૧૦ કાનજી વિશરામ	,,
૧૧૧ જીવરાજ મુળજી	,,
૧૧૨ ભાણજી વિશરામ	,,
૧૧૩ કાનજી ખેતસી	,,
૧૧૪ કરમસી પચાણ	,,
૧૧૫ મનજી લાલજી	,,
૧૧૬ વેલજી નથુરામ	,,
૧૧૭ રવજી પ્રેમજી	,,
૧૧૮ કાન્તીલાલ લાલજીભાઈ	નવટાંકી
૧૧૯ વશરામ કાનજી	,,
૧૨૦ નારાયણ હંશરાજ	,,
૧૨૧ સવજી કાનજી	,,
૧૨૨ મણીલાલ હંશરાજ	,,
૧૨૩ કેશવલાલ માવજીભાઇ	હીરાપુર
૧૨૪ વશરામ નાનજી	,,
૧૨૫ દેવશી નાનજી	,,
૧૨૬ રવજી અરજણ	,,
૧૨૭ શાન્તીલાલ રામજી	,,
૧૨૮ પ્રેમજી લાલજી	,,
૧૨૯ ગોપાળ કાનજી	,,
૧૩૦ રત્નાભાઇ અરજણ	,,

realpatidar.com

https://archive.org/details/bk1437/page/n11/mode/1up

realpatidar.com

	નામ	ગામ
૧૩૧	પરબત વાલજી	હીરાપુર
૧૩૨	કેશવલાલ કરમશી	,,
૧૩૩	કેશવલાલ માવજી	,,
૧૩૪	લાલજીભાઇ ખેતસીભાઈ	સરડી કંપા
૧૩૫	રામજી રતનશી	,
૧૩૬	વિઠલ દેવજી	,,
૧૩૭	ભાનુપ્રસાદ નારાયણજી	,,
૧૩૮	કરસન જેઠાભાઈ	,,
૧૩૯	નાનજી દેવજી	,,
૧૪૦	ખીમજી હરજી	,,
૧૪૧	કાનજી માવજી	,,
૧૪૨	ભાણુજી વેલજી	,,
૧૪૩	અખઇભાઇ પ્રેમજીભાઇ	સરદારપુરા
૧૪૪	ભગવાનભાઇ મુળજીભાઈ	,,
૧૪૫	હીરાભાઇ લાલજીભાઇ	અમીનપુરા
૧૪૬	કાન્તીલાલ સામજી	,,
૧૪૭	નારાયણ સવગણ	,,
૧૪૮	ધનજી ભાણુજી	,,
૧૪૯	મણીલાલ રામજી	,,
૧૫૦	એચરદાસ મનજી	,,
૧૫૧	માવજી કરસન	,,
૧૫૨	નારાયણ ડાહ્યાભાઇ	,,
૧૫૩	ખીમજી કરસન	,,
૧૫૪	દેવજીભાઇ હીરજીભાઇ	દોલપુર
૧૫૫	ખેતસીં સામજી	,,
૧૫૬	પ્રેમજી સોમજી	,,
૧૫૭	નારાયણ લાલજી	,,
૧૫૮	નારાયણ નાનજી	,,
૧૫૯	કાનજી લધા	,,
૧૬૦	પેથા હીરજી	,,
૧૬૧	કાનજીભાઇ પુજાભાઇ	બાણી કંપા
૧૬૨	રાજારામ ગોપાળ	,,
૧૬૩	દેવજી નાનજી	,,

	નામ	ગામ
૧૬૪	ગોવિંદ ગોપાળ	બાણી કંપા
૧૬૫	દેવશી પેથા	,,
૧૬૬	ખેતસીં પુન્જા	,,
૧૬૭	હરીભાઈ ખેતાભાઇ	વિષ્ણુપુરા
૧૬૮	તુલસીદાસ હીરજીભાઈ	,,
૧૬૯	મણીલાલ મેગજી	,,
૧૭૦	કરસન જીવરાજ	,,
૧૭૧	મણીલાલ હીરજી	,,
૧૭૨	રવજી ખેતસીં	,,
૧૭૩	ધનજીભાઇ દેવજીભાઇ	રાજપુર
૧૭૪	પ્રેમજી કરસન	,,
૧૭૫	સવગણ જશભાઇ	,,
૧૭૬	રતીલાલ માવજી	,,
૧૭૭	મનજી વાલજી	,,
૧૭૮	નાનજીભાઇ કાનજીભાઇ	રાયણનો માળ
૧૭૯	રતીલાલ મેઘજી	,,
૧૮૦	નારાયણ પ્રેમજી	,,
૧૮૧	દેવજીભાઈ ધનજીભાઈ	સોની કંપા
૧૮૨	લાલજી પ્રેમજી	,,
૧૮૩	રતીલાલ દેવશી	,,
૧૮૪	વિઠલદાસ રામજી	,,
૧૮૫	મુળજીભાઇ દાનાભાઇ	કુપા કંપા
૧૮૬	પ્રેમજીભાઇ જેઠાભાઈ	એદલપુરા
૧૮૭	જશાભાઇ મુળજી	,,
૧૮૮	કરસન મેઘજી	,,
૧૮૯	સવજી ધનજી	,,
૧૯૦	અરજણ વિશરામ	,,
૧૯૧	ખીમજી સવજી	,,
૧૯૨	અરજણ ભીમજી	,,
૧૯૩	કચરાભાઇ રાજાભાઇ	સજનપુરા
૧૯૪	જેઠાભાઈ કરસન	ગોવિંદપુરા
૧૯૫	વસ્તારામ હંશરાજ	,,
૧૯૬	સવજી હંશરાજ	

realpatidar.com

https://archive.org/details/bk1437/page/n12/mode/1up

realpatidar.com

	નામ	ગામ		નામ	ગામ
૧૯૭	માવજી વાલજી	ગોવિંદપુરા	૨૩૦	નારાયણ કરમસી	,,
૧૯૮	લધાભાઇ ધનજીભાઇ	ધનપુરા	૨૩૧	કરસન ખેતાભાઇ	,,
૧૯૯	નારાયણ સામજી	,,	૨૩૨	મુળજી નાનજી	,,
૨૦૦	શાન્તીલાલ નથુરામ	,,	૨૩૩	રવજી વિશરામ	,,
૨૦૧	કેશવલાલ માવજી	,,	૨૩૪	લાલજીભાઇ મનજીભાઈ	રામપુરા
૨૦૨	પ્રેમજીભાઈ પરબતભાઇ	ગઢ કંપા	૨૩૫	ખેતા રામજી	,,
૨૦૩	કાનજીભાઇ પરબત	,,	૨૩૬	મણીલાલ નાનજી	,,
૨૦૪	દેવજી નારાયણ	,,	૨૩૭	શાન્તીલાલ નાનજી	,,
૨૦૫	સવજીભાઇ હરજીભાઇ	હરિપુરા	૨૩૮	મણીલાલ નારાયણ	રામાપીર
૨૦૬	પચાણ મનજી	માલપુર	૨૩૯	ખેતાભાઇ રામજી	,,
૨૦૭	હરજી દેવજી	,,	૨૪૦	કરસન મેઘજી	,,
૨૦૮	વાલજીભાઇ માવજીભાઇ	ગોવિંદપુરા	૨૪૧	લાલજી રામજી	,,
૨૦૯	રતીલાલ દેવશીભાઇ	નવાનગર	૨૪૨	ભીમજી રામજી	,,
૨૧૦	અખઈભાઇ હંશરાજ	,,	૨૪૩	વિશરામ માવજી	,,
૨૧૧	મુળજી રતનશી	,,	૨૪૪	વાલજી માવજી	,,
૨૧૨	કરમશીભાઈ સવજીભાઇ	મગનપુરા	૨૪૫	જેઠાભાઇ સવગણ	,,
૨૧૩	પ્રેમજી હીરજી	,,	૨૪૬	સામજી લધા	,,
૨૧૪	રેવાભાઈ રામજી	,,	૨૪૭	કાનજી નથુ	,,
૨૧૫	શાન્તીલાલ મેઘજી	,,	૨૪૮	પેથાભાઇ માવજી	,,
૨૧૬	કાનજી સામજી	,,	૨૪૯	નારાયણભાઇ શીવજી	મોતિવેણી
૨૧૭	નારાયણ હંશરાજ	,,	૨૫૦	પ્રેમજી શીવજી	,,
૨૧૮	નારાયણ સવગણ	હીરાખાડી	૨૫૧	કરમશી સવગણ	,,
૨૧૯	નાનજીભાઇ ભાણજી	,,	૨૫૨	જીવરાજ અરજણ	,,
૨૨૦	હરજી પ્રેમજી	,,	૨૫૩	સવગણ કાનજી	,,
૨૨૧	છગનલાલ નાનજી	,,	૨૫૪	માવજીભાઇ પ્રેમજીભાઇ	વજેપુરા
૨૨૨	પચાણભાઈ હંશરાજ	,,	૨૫૫	લાલજી મુળજી	,,
૨૨૩	જેઠાભાઇ કરસન	,,	૨૫૬	હીરજી મુળજી	,,
૨૨૪	અરજણભાઈ લધાભાઇ	ચોગામડા	૨૫૭	રાજારામ વાલજી	,,
૨૨૫	રતીલાલ કાનજીભાઇ	રામસી કંપા	૨૫૮	રતીલાલ ખેતસીં	,,
૨૨૬	સોમજી મનજી	,,	૨૫૯	સામજીભાઈ સવગણ	હરીપુરા
૨૨૭	જીવરામ મણીભાઇ	,,	૨૬૦	હરીભાઇ હીરજીભાઈ	આકરુન્દ
૨૨૮	કરસન નાનજી	,,	૨૬૧	હંશરાજ પચાણ	,,
૨૨૯	વાલજીભાઇ કરમસીભાઇ	કાશીપુરા	૨૬૨	મેગજી લક્ષ્મણ	,,

realpatidar.com

https://archive.org/details/bk1437/page/n13/mode/1up

1955-01-18 -KKP Sanatan Yuvak Sangh Dhansura -Constitution (1437)

realpatidar.com

નામ	ગામ	નામ	ગામ
૨૬૩ લધાભાઇ મેઘજી	આકરૂન્દ	૨૮૨ મેઘજીભાઈ જેઠાભાઇ	મલકાણુા
૨૬૪ દેવજીભાઇ નારાયણુ	શાન્તીપુરા	૨૮૩ રામજીભાઇ દેવશીભાઇ	લક્ષ્મીપુરા
૨૬૫ રામજી નારાયણુ	,,	૨૮૪ રાવજી ભાણુજી	,,
૨૬૬ વશરામ જીવરાજ	,,	૨૮૫ અંબાલાલ ભાણુજી	,,
૨૬૭ પ્રેમજી કરસન	,,	૨૮૬ હંશરાજ સામજી	,,
૨૬૮ મેઘજી ડાહ્યા	,,	૨૮૭ છગનભાઇ પુન્જાભાઈ	,,
૨૬૯ રતીલાલ સવદાસ	,,	૨૮૮ મુળજી વાલજી	,,
૨૭૦ લક્ષ્મણુ નથુરામ	,,	૨૮૯ રવજી લાલજી	,,
૨૭૧ દેવશીભાઇ હીરજીભાઈ	દેશાઇપુરા	૨૯૦ કરસનભાઇ ગોવિંદભાઈ	માધવ
૨૭૨ રવજી લાલજી	,,	૨૯૧ છગનભાઇ તેજાભાઇ	,,
૨૭૩ દેવરામ લાલજી	,,	૨૯૨ સામજી રામજી	,,
૨૭૪ લાલજી પ્રેમજી	,,	૨૯૩ પ્રેમજી લધા	,,
૨૭૫ જેઠાભાઇ સવગણુ	,,	૨૯૪ લાલજી વાલજી	,,
૨૭૬ નાનજી નારાયણુ	,,	૨૯૫ કરસન લધા	,,
૨૭૭ સોમજી નારાયણુ	,,	૨૯૬ મણીલાલ ખીમજી	,,
૨૭૮ નાનજી ધનજી	,,	૨૯૭ વશરામભાઇ જીવરાજ	થવાદ
૨૭૯ અરજણુભાઇ વશરામ	ઓરીયા ટીંબા	૨૯૮ ભાનુશંકર મણીલાલ	બાયડ
૨૮૦ હરદાસ માવજી	,,	૨૯૯ રતીલાલ ગોવિંદભાઇ	ડેમાઇ
૨૮૧ નારાયણુ કાનજી	,,	૩૦૦ ભાઇલાલભાઇ હીરજીભાઇ	,,

એ રીતે લવાજમ ભરેલા ૩૦૦ સંઘના સભ્યો છે. બાકીના કેટલાક નોંધાયલા યુવકોનાં હજુ લવાજમો આવ્યા નથી. તો દરેક નવા તેમજ જુના સભ્યો વહેલી તકે સમાજની ઓફીસે આવી લવાજમો ભરી જવા નોંધ લે. એજ.

તા. ક.–ફરજિઆત બચત પ્રથા દાખલ કરી આપણુા બાળકોને બને તેટલી કેળવણીમાં મદદ કરવા આ સંઘનો મુખ્ય આદેશ છે.

લી. આપનોજ

વેલજીભાઈ પ્રેમજીભાઇ

પ્રમુખ,

યુવક સંઘ-ધનસુરા.

---

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1437/page/n14/mode/1up

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk1437/page/n15/mode/1up

realpatidar.com

શ્રી મહાલક્ષ્મી પ્રિન્ટીંગ પ્રેસ-ધનસુરા.

realpatidar.com